



Australian Government

હવે જ્યારે આપણે બધા પાછા બહાર નીકળી રહ્યા છીએ,
ત્યારે COVIDથી સલામત રહેવું,

આપણા બધા પર આધાર રાખે છે
આ 3 કરો



હાથ ધુઓ



શારીરિક અંતર રાખો



એપ રાખો

અને જો તમને શરદી અથવા તાવ સાથે સળેખમનો અનુભવ થતો હોય, તો ઘરે રહો અને તપાસ કરાવવા માટે તમારા ઠાકતર સાથે વાત કરો.

COVIDSAFE રહો

કોરોનાવાઇરસ (COVID-19) વિષે વધુ માહિતી માટે,
health.gov.au ની મુલાકાત લો.

